

10th April, 2025**BSE Limited**Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai 400 001**BSE Scrip Code: 500259****National Stock Exchange of India Limited**Plot No. C/1, G. Block
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai - 400 051**NSE Symbol: LYKALABS**

Dear Sir/ Madam,

Sub.: Intimation of Newspaper Advertisement — Notice of Hearing of the Joint Petition filed under Sections 230-232 of the Companies Act, 2013 before the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ("Hon'ble NCLT") in the matter of Scheme of Amalgamation of Lyka Exports Limited ("Transferor Company") and Lyka Labs Limited ("Transferee Company") and their respective Shareholders and Creditors ("Scheme")

This has reference to our earlier intimation dated 1st April, 2025, wherein we had informed that the Hon'ble National Company Law Tribunal ("NCLT"), vide its Order dated 26th March, 2025, has fixed the hearing of the Joint Petition on 15th May, 2025. The Joint Petition has been filed under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013, read with the rules framed thereunder, for sanctioning the Scheme.

Pursuant to the directions contained in the aforesaid Order of the Hon'ble NCLT, notice of hearing in respect of the said Joint Petition scheduled on 15th May, 2025, before the Hon'ble NCLT has been published in the following newspapers:

Sr. No.	Name of Newspaper(s)	Edition(s)	Publication Date
1	Financial Express - English	All-India	10 th April, 2025
2	Janadesh- Gujarati	Ahmedabad	

A copy of the said publication is attached herewith for your reference. The above information is also being made available on the Company's website at www.lykalabs.com.

Kindly take the same on your record.

Thanking You,

Yours faithfully,

For **Lyka Labs Limited**

Shekhar R Singh

Company Secretary

Encl.: as above

TELECOM SERVICE PROVIDER’S 5G TRAIL EXPANDS BEYOND MUMBAI IN APRIL

5G: Vi sets sights on Delhi, Bengaluru

● Company banks on digital push to fuel cash flow

URVI MALVANIA
Mumbai, April 9

AFTER LAUNCHING COMMERCIAL 5G services in Mumbai, Vodafone Idea plans to expand its next-generation telecom offerings to Delhi, Chandigarh, Bengaluru, and Patna in April, the company said in an investor update on Wednesday.

The update also outlined Vodafone Idea’s strategy to drive growth on the back of digital transformation, customer experience, and enterprise partnerships. The update comes weeks after it got relief in the form of the government’s approval to convert part of its spectrum debt amounting to ₹36,950 crore into equity, providing the telco with cash flow ease.

Post the conversion, the

SIGNAL CHECK

5G rollout: Delhi, Chandigarh, B’luru, Patna in April

Growth drivers: Digital, CX, and partnerships

Focus areas: 17 priority circles

4G goal: **90%** coverage by March 2026.

5G delay: Helps tech adoption, cost savings

Arpu push: Migrate 2G users to 4G, upsell data



Users:
199.8M total
73.8M non-data users

Upgrade scope: 37% can move to 4G

Data usage: Jumped from 0.2GB to 21GB (CAGR 75.9%)

Govt relief: **₹36,950 cr** dues converted to equity

Ownership: Govt 49%, Vodafone 16%, ABG 9.5%.

government will hold 48.99% in the telco, while promoters Vodafone Group UK (16.07%) and the Aditya Birla Group (9.5%) will hold around 26.2%.

Vodafone Idea reiterated that its investments will focus on 17 circles to improve competitiveness in priority markets as it undertakes 4G coverage and capacity expansion and 5G rollout.

As a result of these initiatives, it expects its 4G popula-

tion coverage to reach 90% by March 2026, as compared to 82% at the end of March 2025, and 74% at the end of March 2020.

Vodafone Idea has given a capex guidance of ₹10,000 crore for FY25 focussed towards its network expansion initiatives, and had deployed ₹5,000 crore capex in the first nine months of FY25, according to disclosures made at the end of the December quarter.

It also said that late adoption of 5G is “leading in embracing latest advanced technology products and cost efficiency”, in the investor update filed to the exchanges.

On improving average revenue per user (ARPU), the telco said its network upgradation provides the opportunity to upgrade customers to higher tariff data packs and plans by migrating 2G customers to 4G. According to data in the

presentation, out of 199.8 million subscribers, Vodafone Idea has 73.8 million non-data subscribers. “Nearly 37% of subscribers can potentially upgrade to 4G network,” the telco said, adding that users on unlimited data plans have three times the ARPU of those not on these plans.

Vodafone Idea also said that future tariff hikes, especially in light of increased data consumption, provide headroom for ARPU growth. The telco’s chief executive Akshaya Moondra has long maintained that the industry needs a revision not only in base tariffs, but also in the way that telcos charge users.

His stance has been that the practice of a blanket charge, irrespective of the quantum of data consumption by the user, is not sustainable and will not help improve returns on capital invested. Instead, Moondra has said, telcos need to start charging higher to users who have higher consumption.

IndiGo overtakes Delta, briefly

INDIGO BRIEFLY

BECAME the world’s most valuable airline on Wednesday, surpassing Delta with a market cap of \$23.24 billion as its shares touched -5,265. By market close, its valuation dipped to \$23.16 billion, just below Delta’s. IndiGo now ranks second globally by market cap—a remarkable feat for an airline that began in August 2006. Just six years ago, Delta was worth \$36.67 billion, while IndiGo stood at \$7.72 billion.



Top global listed airlines by market cap (in \$ billion)

Delta Air Lines	23.18
InterGlobe Aviation (IndiGo)	23.15
Ryanair Holdings	21.41
United Airlines Holdings	18.46
Air China	15.27
International Consolidated Airline	13.98
Southwest Airlines	14.20
Singapore Airlines	13.23
China Southern Airlines	12.42
Turk Hava Yollari AO	11.21

Source: Bloomberg

Prestige Estates launched ₹16,134 cr projects in Q4

FE BUREAU
Mumbai, April 9

PRESTIGE ESTATES PROJECTS said on Wednesday that it launched 14 million sq ft of residential properties across its key markets in Q4 FY25, with a gross development value (GDV) of ₹16,133.8 crore.

This is a sharp increase from the 0.83 million sq ft launched in Q4 FY24. During FY24, the company launched a total of 31.67 million sq ft of residential space.

The new launches in Q4 FY25 span Bengaluru, Mumbai, and Hyderabad, covering a total developable area of 14.03 million sq ft and comprising 4,548 units, the company said.

Although the larger project launches took place towards the latter half of the quarter, we were still able to achieve impressive sales numbers before the quarter ended.

This enabled us to make a meaningful contribution to the quarter’s overall performance, the company said in a release.

Further, the company said that its new project in Mumbai

REALTY CHECK

■ 14 mn sq ft of residential space

■ **GDV:** ₹16,133.8 cr for Q4 FY25 launches

■ **Q4 FY24 comparison:** Only 0.83 mn sq ft launched

Sales (in a month, ₹ cr)	
Mumbai	2,385.7
Bengaluru	1,382.1
Hyderabad	1,110.1

recorded sales of ₹2,385.7 crore within a month, while launches in Bengaluru and Hyderabad achieved ₹1,382.1 crore and ₹1,110.1 crore in sales respectively, in the final days of the quarter.

Godrej Properties and Macrotech Developers, who released their operational updates, did not release their launch numbers.

QUICK PICKS

Kopi Kenangan enters India, aims to open 10 stores

INDONESIAN COFFEE CHAIN Kopi Kenangan is entering India with its first store in Delhi’s Pacific Mall and plans to open 10 stores during the first year here, its group CEO and co-founder Edward Tirtanata said on Wednesday. He said the company is looking at India as a big opportunity and would take the store count in the country to 50 over the next three years.

—FE BUREAU

Ola Electric ropes in EY for regional compliance

OLA ELECTRIC MOBILITY has roped in Ernst & Young to strengthen regional compliances across its recently expanded distribution network in the country, according to sources familiar with the development. The company has initiated the move as it phases out its warehouse-based distribution system and transitions to a direct-to-store retail model.

—PTI

Airbus to buy \$2 bn of parts from India each year by 2030

MIHIR MISHRA
April 9

AIRBUS PLANS to bolster its sourcing from India to \$2 billion a year by 2030—a jump of almost 43% from the current levels—as it eyes growing sales in the South Asian nation’s booming aviation market.

“We have a target,” Remi Maillard, president and managing director of Airbus in India and South Asia, told reporters in New Delhi, adding that this quantum of sourcing will be achieved “well before 2030.”

The Toulouse, France-based firm sourced \$1.4 billion of products from India in 2024, an increase of 40% from the previous year, Maillard said. That compares with \$500 million worth of procurement from India in 2019, he said.

The decision to boost sourcing reflects India’s growing importance, with its domestic aviation market ranked the world’s third largest. Airbus in 2022 estimated India will need 2,210 new aircraft over the next 20 years. Indian carriers have a pending order book of about 1,800 aircraft—one of the world’s largest order pipelines—with Airbus and rival Boeing.

The growth in sourcing from India is unprecedented despite the numerous approvals and procedures that are required, he said.

SCALING HIGH



■ India’s aviation market is now the 3rd largest globally

■ \$1.4 bn sourced in 2024—up 40% from 2023

■ Airbus partners with Mahindra Aerostructures for H130 fuselage

■ Deliveries from Mahindra to begin March 2027

Airbus is one of the biggest suppliers to IndiGo and Air India, two of the country’s largest carriers.

Maillard, who was speaking at an event to announce a partnership with Mahindra Aerostructures, said the Indian company will manufacture fuselage for its single engine H130 helicopters.

Mahindra Aerostructures will start deliveries to Airbus from March 2027, the Indian company said in a statement.

—BLOOMBERG

Task-specific AI to triple LLM use by ’27: Gartner

FE BUREAU
Bengaluru, April 9

GARTNER SEES the use of small, task-specific artificial intelligence (AI) models will be at least three times greater than that of general-purpose large language models (LLMs) in organisations by 2027. This expected shift is being driven by the increasing demand for contextualised, reliable and cost-effective solutions in business operations.

General-purpose LLMs are currently valued for their broad language capabilities. However, their performance tends to decline when used for tasks that require in-depth understanding of a particular business domain. According to Gartner, this limitation is prompting organisations to focus on specialised models tailored to specific business functions.



“The variety of tasks in business workflows and the need for greater accuracy are driving the shift towards specialised models fine-tuned on specific functions or domain data,” said Sumit Agarwal, VP Analyst at Gartner. “These smaller, task-specific models provide quicker responses and use less computational power, reducing operational and

maintenance costs.”

Gartner explained that enterprises can develop these models using approaches such as retrieval-augmented generation (RAG) or fine-tuning techniques. These methods allow companies to adapt existing LLMs to meet their own specific needs, using enterprise data as the core differentiator.

Darshan Mehta, ex-MD of Reliance Brands, dies

VIVEAT SUSAN PINTO
Mumbai, April 9

DARSHAN MEHTA, FORMER managing director and CEO of Reliance Brands—a part of Reliance Retail—passed away on Wednesday at the age of 64. Sources said he suffered a heart attack while on a trip to Hyderabad. Mehta was widely known for transforming India’s luxury and lifestyle retail landscape, playing a key role in bringing some of the world’s most iconic premium labels to the country.



Mehta was the MD of Reliance Brands, a company he was associated with for 18 years, before becoming a non-executive director on the firm’s board last November. A chartered and

cost accountant by qualification, Mehta did his articleship with PriceWaterhouse in Mumbai in the early 1980s before joining the Arvind group in 1984. He worked with the group for a total of 23 years in various capacities.

But it was as president of Arvind Brands between 2001 to 2007 that he honed his lifestyle retailing skills, where he was instrumental in introducing international sportswear brands like Tommy Hilf, Gant, and Nautica to the Indian market.

BEFORE THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL BENCH, AT AHMEDABAD
FORM NO. NCIT. 3A
Advertisement detailing petition
[Pursuant to Rule 35 of National Company Law Tribunal Rules, 2016]
C.P (C.A.A.)/18 (AHM) 2025
IN
C.A (C.A.A.)/58 (AHM) 2024
In the matter of the Companies Act, 2013
And
In the matter of Sections 230 to 232 of the Companies Act, 2013 and other applicable provisions of the Companies Act, 2013 read with Companies (Compromises, Arrangements and Amalgamation) Rules, 2016
And
In the matter of Scheme of Amalgamation of Lyka Exports Limited ("Transferor Company") and Lyka Labs Limited ("Transferee Company") and their respective shareholders and creditors
Lyka Labs Limited
CIN: L24230GJ1976PLC008738
A Company incorporated under the provisions of Companies Act, 1956 having its registered office at 4801/B & 4802/A GIDC Industrial Estate, Ankleshwar-393002, Gujarat, India. ...Petitioner Company 1/ Transferor Company
Lyka Exports Limited
CIN: U51100GJ1992PLC023975
A Company incorporated under the provisions of Companies Act, 1956 having its registered office at Plot No C/4/10/B/2nd Floor Adarsh Industrial Complex Opp: S B I Ankleshwar, Bharuch-393002, Gujarat, India. ...Petitioner Company 2/ Transferee Company

NOTICE OF PETITION
A joint Petition in relation to Scheme of Amalgamation of Lyka Labs Limited ("Transferor Company") and Lyka Exports Limited ("Transferee Company") and their respective shareholders and creditors ("Scheme") under Sections 230 to 232 of the Companies Act, 2013 was presented by the Transferor Company and Transferee Company was heard and admitted by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ("NCLT") on 26th March, 2025 and the said petition is fixed for final hearing before the Hon'ble NCLT on 15th May, 2025.
Any person desirous of supporting or opposing the said petition should send to the Petitioner or Petitioners' Authorised Representative, notice of his intention, signed by him or his advocate, with his name and address, so as to reach the Petitioners' registered office or Petitioners' Authorised Representative not later than two days before the date fixed for the hearing of the petition. Where any person seeks to oppose the petition, the grounds of opposition or a copy of his affidavit shall be furnished with such notice.
A copy of the petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same.
Dated: April 10, 2025
Place: Ahmedabad

Sd/-
Ms. Dharmishta N. Raval
Advocate for the Petitioner Companies
En. No. G/669/1980, Bar Council of Gujarat,
Raval & Raval Advocates
602-604, City Centre 2, Next to Hir Party Plot,
Near CIMS Hospital, Science City Road, Ahmedabad - 380060
Email: ravalandraval@gmail.com
Mobile No.: 9825009525

BSE
The Bombay Stock Exchange
BSE LIMITED
CIN: L67120MH2005PLC155188
Registered Office: 25th Floor, P. J. Towers, Dalal Street, Mumbai - 400 001
Tel.: +91 22 2272 1233/34 | Email: bse.shareholders@bseindia.com | Website: www.bseindia.com

NOTICE TO SHAREHOLDERS
Shareholders are hereby informed that pursuant to Section 108 and 110 and other applicable provisions of the Companies Act, 2013, if any, read with the Rule 20 and 22 of Companies (Management and Administration) Rules, 2014, and applicable provisions of Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 ("SEBI ICDR"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular No. 9/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs, in continuation to the Circulars issued earlier in this regard ("MCA Circulars") and subject to any other applicable laws, rules and regulations (including any modification(s) or amendments(s) thereof for the time being in force), BSE Limited ("the Company") has dispatched the Postal Ballot Notice along with the Explanatory Statement ("Postal Ballot Notice") on Wednesday, April 9, 2025, through electronic mode to the Shareholders whose email addresses were registered with the Company's Registrar and Share Transfer Agent, KFin Technologies Limited ("RTA")/ Depositories, as on Friday, April 4, 2025 ("Cut-off date") for seeking consent of the Shareholders on the below proposal through Postal Ballot, only by way of e-Voting process:

1. Issue of Bonus Shares

In compliance to the MCA Circulars, physical copy of the Postal Ballot Notice along with Postal Ballot forms and pre-paid business envelopes is not being sent to the Shareholders for the Postal Ballot.
The Company has engaged the services of Central Depository Services (India) Limited ("CDSL") for the purpose of providing e-Voting facility to all its Members. The e-Voting facility will be available during the following period:

Commencement of e-Voting:	Thursday, April 10, 2025 (9:00 A.M. - 5:00 P.M.)
Conclusion of e-Voting:	Friday, May 9, 2025 (05:00 P.M. - 12:00 P.M.)

The e-Voting service shall be disabled by CDSL upon conclusion of e-Voting period and Shareholders will not be allowed to vote beyond the said date and time. The voting rights of the Shareholders shall be in proportion to the shares held by them in the paid-up equity share capital of the Company as on the Cut-off date. A person, whose name appears in the Register of Members of the Company as on the Cut-off date, shall only be entitled to vote using e-Voting facility. A person who is not a Shareholder as on the Cut-off date should treat this Notice for information purpose only.

In accordance with SEBI ICDR, the new equity shares to be allotted pursuant to the bonus issue shall be allotted in dematerialised form only and shall be credited to the respective demat account. **In view of the same, Shareholders holding the shares in physical mode are requested to dematerialize their shares or the Shareholders whose demat account is not operational due to various reasons are requested to activate the demat account.** The said requirements are required to be completed on or before the Record Date as may be determined by the Board for this purpose which shall be announced separately on the National Stock Exchange of India Limited ("NSE") (where the Company is listed). Non-dematerialization of physical shares or de-activation of demat account would result in bonus shares being credited to a Suspense Escrow Demat Account of the Company wherein the Voting rights on such bonus equity shares would remain frozen. Members can contact the Company's RTA for assistance in this regard.

The Company has appointed M/s. N.L. Bhatia and Associates, Practicing Company Secretaries (UIN: P1996MH055800), to act as the Scrutinizer for conducting the Postal Ballot through e-Voting process.

Detailed instructions for e-Voting are provided in the Postal Ballot Notice.
The results of e-Voting by means of Postal Ballot along with the Scrutinizer's Report would be displayed on the Notice Board of the Company at its registered office and shall be placed on the website of the Company (www.bseindia.com) and on the website of CDSL (www.cdslindia.com) and the same shall be intimated to the NSE within two working days of conclusion of the e-Voting. In case of any query and/ or grievance with respect of e-Voting, Shareholders may refer to the Frequently Asked Questions ("FAQs") under the help section of CDSL website at www.evotingindia.com or contact Mr. Rakesh Dalvi, Sr. Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futures, Malatlal Mill Compounds, N M Joshi Marg, Lower Panel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 21 09913 for any further clarifications. Further, in case of any other query and/ or grievance with respect to Postal Ballot, Shareholders are requested to contact the Company at bse.shareholders@bseindia.com.

By Order of the Board of Directors
For BSE Limited
Sd/-
Vishal Bhat
Company Secretary

Date: April 10, 2025
Place: Mumbai

NOTICE

NOTICE is hereby given that Pursuant to Regulation 59(A) of SEBI (Mutual Funds) Regulations, 1996 and Para 5.1 of SEBI Master circular no. SEBI/HO/IMD/IMD-PoD-1/P/CI/R/2024/90 dated June 27, 2024, the half-yearly statement of scheme portfolio for the half year ended March 31, 2025, is hosted on the website of the Kotak Mahindra Mutual Fund viz. www.kotakmf.com and on the website of AMFI viz. www.amfiindia.com.

The unitholders can also submit a request for a physical or electronic copy of the half-yearly statement of scheme portfolio by sending an SMS through registered mobile number on 9167573281 or by calling on 18003091490 / 044-40229101 or by sending an email to mutual@kotak.com or by writing a letter to Kotak Mahindra Asset Management Company Ltd, at the address mentioned below.

For Kotak Mahindra Asset Management Company Limited
Investment Manager – Kotak Mahindra Mutual Fund
Sd/-
Authorised Signatory

Mumbai
April 09, 2025

Any queries / clarifications in this regard may be addressed to:
Kotak Mahindra Asset Management Company Limited
CIN: U65991MH1994PLC080009 (Investment Manager for Kotak Mahindra Mutual Fund)
6th Floor, Kotak Towers, Building No.21, Infinity Park, Off: Western Express Highway, Goregaon - Mulund Link Road, Malad (East), Mumbai - 400 097.
Phone Number: 18003091490 / 044-40229101 • Email: mutual@kotak.com • Website: www.kotakmf.com

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

MUTUALFUNDS
Sahi Hai

uti
UTI Mutual Fund
Hag, ek behtar zindagi ka.

NOTICE

Hosting of the half-yearly statement of schemes portfolio of UTI Mutual Fund

NOTICE is hereby given to all Unit holder(s) of UTI Mutual Fund "Schemes" that in accordance with Regulation 59(A) of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 and Circulars issued by SEBI from time to time. The half-yearly statement of schemes portfolio of all Schemes for the Half year ended March 31, 2025 have been hosted on our website viz. www.utimf.com, and on website of AMFI viz. www.amfiindia.com

Investor can also request for physical or electronic copy of the half-yearly statement of its schemes portfolio through any of the following means

- SMS:** Send SMS to '5607090' from investor's registered mobile number. SMS format HYP <Folio> Example HYP '123456789' to 5607090.
- Telephone:** Give a call to our Contact Centre on 18002661230 (Toll Free). Landline-022-62278000
- Email:** Send an email to 'service@uti.co.in'
- Letter:** Submit a request letter at any of our UFCs/OPAs quoting your folio no. List of UFCs available at www.utimf.com.

Mumbai
April 09, 2025

Toll Free No.: 1800 266 1230

www.utimf.com

REGISTERED OFFICE: UTI Tower, 'Gri' Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. Phone: 022 - 66786666. UTI Asset Management Company Ltd. (Investment Manager for UTI Mutual Fund) E-mail: invest@uti.co.in, (CIN:U65991MH2002PLC137867). For more information, please contact the nearest UTI Financial Centre or your AMFI/ NISM certified Mutual fund distributor, for a copy of Statement of Additional Information, Scheme Information Document and Key Information Memorandum cum Application Form.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

